

રૂ. ૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર

જામીનખત નમૂનો

(૧) આ લેખ ઉપરથી.....જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ને જણાવું છું એ, રહેવાસી.....ગામ.....તાલુકો.....જિલ્લો.....અને ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ નં. પીઆરઇ/ ૧૧૨૦૧૭/સીગલ ફાઇલ- ૬/ક, તા.૨૨/૦૩/૨૦૧૭ માં દર્શાવેલ શરતોને આધીન રહીને તેમજ વખતોવખત થનાર સૂચના આધિન રહીને શિક્ષણ સહાયક તરીકે નોકરીમાં દાખલ થયા પહેલાની અને પાછળનીજિલ્લાની તાલુકાની શાળામાં શિક્ષણ સહાયક તરીકેની જગ્યા પર નિમણૂક માટે પસંદ કરાયેલા ઉમેદવાર (ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી (હવે પછી અહીં સરકાર તરીકે ઉલ્લેખ કરાયેલ છે) અને સંદર્ભથી અન્યથા જરૂરી બનાવ્યું ન હોય તે સિવાયના જે શબ્દ પ્રયોગોમાં તેમના ઉત્તરાધિકારીઓ અને નામફેર કરી લેનારાઓનો સમાવેશ થાય છે.) તરીકે સરકારને રૂ.૩,૦૦,૦૦૦/-અંકે રૂપિયા ત્રણ લાખ પુરાની રકમ ચુકવવા માટે નીચે જણાવેલ વિગતે આ લેખથી જવાબદાર બનું છું અને તેને માટે મારી અને મારા વારસો, મૃત્યુ પત્ર ચલાવનારાઓ, વહીવટકર્તાઓ અને કાયદેસરના પ્રતિનિધિઓને બાંધુ છું.

(૨) આ યોજના દ્વારા મને ખ્યાલ આપવામાં આવ્યા પ્રમાણે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી- ૨૦૧૯-૨૦ની તા.૧૯/૧૧/૨૦૧૯ની જાહેરાત અન્વયે જિલ્લાના તાલુકાની શાળામાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક આપવામાં આવતાં નિમણૂક હૂકમની શરતો મુજબ હું તા.....ના રોજ નિમણૂક મેળવવા હાજર થયેલ છું. શિક્ષણ વિભાગના તા.૨૨/૦૩/૨૦૧૭વાળા ઠરાવ મુજબ શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં નિમણૂક ત્રણ વર્ષની અંદર તેજ સંવર્ગની જગ્યા માટે ઉમેદવારી કરવા માટેની જોગવાઈઓ નક્કી કરવામાં આવેલ છે જેનું હું પાલન કરીશ.

હવે ઉપર લેખિત જામીનગીરીની શરત એવી છે કે, આ યોજના (જે યોજના આ લેખના ભાગરૂપ ગણાશે) માં જણાવ્યા પ્રમાણે મારે પાલન કરવાના બોલ તથા બજાવવાની શરતોનું હું વિધિસર અને નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તથા બજાવીશ તો ઉપરની જામીનગીરી રદ થયું ગણાશે. જામીનગીરીમાં આપેલ શરતો મુજબ હું મારી ફરજ બજાવું નહીં તો આ જામીનગીરી પુરેપુરી અમલમાં અને અસરકારક રહેશે.

પરંતુ હક્ક અને ઉપચારોને બાદ લાવ્યા વગર આ જામીનગીરી હેઠળ અગર ચુકવવાની રકમ જમીન મહેસુલની બાકી વસુલાત તરીકે મારી પાસેથી જો હું જામીનગીરીમાં દર્શાવેલ રકમ ભરવામાં નિષ્ફળ જાઉં તો મારા જામીન પાસેથી લેવાની સરકારને છુટ રહેશે. જેની શાખરૂપે મેં આજરોજ સનેમાહે.....માસનીતારીખે જામીનગીરી પર મારી સહી કરી છે.

ઉપર જણાવેલ નામવાળાએ નીચેનાની હાજરીમાં સહી કરી અને સોપ્યું.

ઉમેદવારની સહી

રહેઠાણનું પુરેપુરું સરનામું:

ગામ.....તાલુકો.....જિલ્લો.....

સાક્ષીઓની સહી

૧) સહી

રહેઠાણનું પુરેપુરું સરનામું:

ગામ.....તાલુકો.....જિલ્લો.....

(૨) સહી

રહેઠાણનું પુરેપુરું સરનામું:

ગામ.....તાલુકો.....જિલ્લો.....

મારી રૂબરૂ
જિલ્લા શિક્ષણાધિકારી